

મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા પામેલ અને જેલમાંથી ફર્લો રજા મેળવી સાત મહીનાથી ફરાર થયેલ રીઢા ગુનેગાર દિપક મંગા મારૂને ચોરીની મોટર સાયકલ સાથે ઝડપી પાડતી, સુરત શહેર કાઈમ બ્રાંચ.

સુરત શહેર વિસ્તારમાં ગંભીર ગુનાઓમાં સજા પામેલ તેમજ કાચા કામના કૈદી તરીકે જેલમાંથી પેરોલ રજા, ફર્લો રજા અને વચગાળા જામીન મેળવી ફરાર થયેલ હોય, તેવા રીઢા ગુનેગારો સત્વરે પકડી પાડવા, કાઈમ બ્રાંચ પેરોલ ફર્લો સ્કોડના પોલીસ માણસોની ટીમ કામગીરીમાં રોકાયેલ હતી. દરમ્યાન પો.સ.ઈ.પી.કે.પટેલ નાઓની ટીમના હે.કો. શૈલેશ રાઘેબીહારી અને પો.કો.મનોજ તુકારામનાઓને મળેલ હકીકત આધારે વચગાળાની જામીન પરથી ફરાર થયેલ આરોપી:- દિપક મંગા મારૂ ઉ.વ.૪૮ રહે. સૈયદપુરા માર્કેટ વકીલ સ્ટ્રીટની પાછળ પ્રેમગલી ઝુપડપટ્ટી, સૈયદપુરા, સુરત મુળ ગામ-મણાર તા-તળાજા જી-ભાવનગરનાને નવસારી બજાર મચ્છી માર્કેટ પાસે જાહેર રોડ પરથી લાલગેટ પો.સ્ટે. વિસ્તારની ચોરીની મોટર સાયકલ સાથે પકડી પાડેલ.

સદર ફર્લો રજા પરથી ફરાર આરોપીએ સને ૨૦૦૮ માં અંગત અદાવતમાં ચોકબજાર વિસ્તારમાં પાસે ગણેશ ઉર્ફે માંજરા નામના ઈસમને જાહેરમાં ફટકા અને ચાકુના જીવલેણ ઘા મારી હત્યા કરેલ હતી. તે બાબતે ચોકબજાર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૨૫/૨૦૦૮ ઈ.પી.કો.કલમ-૩૦૨ વિગેરે મુજબથી ગુનો રજીસ્ટર થયેલ હોય, સદર આરોપીને સદર ગુનામાં તા.૧૨/૦૭/૨૦૧૧ ના રોજ આજીવન કેદની સજા થયેલ હોય અને સદર આરોપી હાલ લાજપોર મધ્યસ્થ જેલમાં પાકા કામના કૈદી તરીકે રહેતો હોય, સદર આરોપી તા.૨૯/૧૦/૨૦૧૮ થી તા.૧૩/૦૧૧/૨૦૧૮ સુધી દિન-૧૪ ની ફર્લો રજા પર જેલમાંથી બહાર આવેલ ત્યારબાદ તેને તા.૧૩/૧૧/૨૦૧૮ ના રોજ લાજપોર મધ્યસ્થ જેલ સચીન, સુરત ખાતે હાજર થવાનું હતું પરંતુ આરોપી સમયસર હાજર નહી થઈ ફર્લો રજા ઉપરથી ફરાર થઈ ગયેલ હતો. દરમ્યાન પોલીસ માણસોને મળેલ બાતમી આધારે ચોરીની મોટર સાયકલની સાથે પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.

ડીટેક્ટ કરેલ ગુના :- (૧) લાલગેટ પોલીસ સ્ટેશન ॥ ગુ.ર.નં.૧૧૯૨/૨૦૧૯ પ્રિઝનલ એક્ટ કલમ ૫૧(એ), ૫૧(બી) મુજબના ગુનાના કામે નાસતો-ફરતો. (૨) લાલગેટ પોલીસ સ્ટેશન ॥ ગુ.ર.નં. ૫૦/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો અન-ડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરેલ છે. આરોપીનો અગાઉનો ગુનાહીત ઈતિહાસ:- (૧) મર્ડર-૦૧ (૨) ચોરીના ગુના-૧૬, (૩) ઘરફોડ ચોરી ગુના-૦૪ (૪) શરીર સંબંધી ગુના-૦૬ (૫) લુંટના ગુના-૦૩ મળી કુલ-૩૦ ગુનાઓમાં પકડાયેલ છે.